

CIN: L99999GJ1987PLC009768

Regd. Office: 9-10, GIDC Industrial Estate, Waghodia, Dist.: Vadodara, 391760

Ph.:75 748 06350 | E-Mail: co secretary@20microns.com | Website: www.20microns.com

May 24, 2025

To,
The Secretary, **BSE Ltd.**25<sup>th</sup> Floor,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai - 400 001 **Scrip Code -** 533022

To,
Asst. Vice President,
National Stock Exchange of India Ltd.,
Exchange Plaza, Plot C/1, G Block
Bandra-Kurla Complex,
Bandra (E),
Mumbai - 400 051
Symbol - 20MICRONS

Dear Sirs,

Subject: Newspaper Advertisement - Disclosure under Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A and Regulation 47 of SEBI Listing Regulations, we hereby enclose copies of newspaper advertisement published regarding extract of the Audited Consolidated and Standalone Financial Results for the quarter and year ended March 31, 2025, in following newspapers:

- **1)** Business standard (English)
- **2)** The Economic Times (English)
- **3)** Loksatta Jansatta (Gujarati)

This is for your information and records.

Thanking you,

Yours faithfully

**For 20 Microns Limited** 

### **Komal Pandey**

Company Secretary & Compliance Officer ACS 37092

Encl.: as above

Date : May 22, 2025

(Aurangabad), India

## Morgan MORGANITE CRUCIBLE (INDIA) LIMITED

Advanced Materials

CIN:L26920MH1986PLC038607. Registered Office: B-11, MIDC Industrial Area, Waluj, Chhatrapati Sambhajinagar (Aurangabad) - 431136,

e-mail: pooja.jindal@morganplc.com website:www.morganmms.com

### Statement of audited financial results for the fourth quarter & year ended March 31, 2025

The Board of Directors of the company at the meeting held on May 22, 2025, approved the audited financial results for the fourth guarter & year ended March 31, 2025 (Financial Results)

The Financial results along with limited review report have been posted on the Company's website at https://www.morganmms.com/engb/morganite-crucible/ financial results and can be accessed by scanning the QR code.

FOR MORGANITE CRUCIBLE (INDIA) LIMITED Jonathan Percival Place: Chhatrapati Sambhajinagar **Director** DIN: 09701284



CIN: L99999GJ1987PLC009768

Regd. Office: 9-10, GIDC Industrial Estate, Waghodia - 391 760. Dist.: Vadodara Ph.: 75748 06350 E-mail: co secretary@20microns.com Website: www.20microns.com

### **Statement of Audited Financial Results (Standalone and** Consolidated) for the Quarter and Year Ended March 31, 2025

The Board of Directors of the Company, at its meeting held on May 23, 2025, approved the Audited Financial Results (Standalone and Consolidated) of the Company for the quarter and year ended March 31, 2025 ("Financial Results").

The Financial Results have been posted on the Company's website and are accessible at: https://www.20microns.com/financial-result

You may also access the results by scanning the QR code below:



For and on behalf of the Board of Directors **20 Microns Limited** 

Rajesh C. Parikh **Chairman & Managing Director** 

DIN: 00041610

Place : Mumbai

Date : 23<sup>rd</sup> May, 2025

Note: This intimation is made pursuant to Regulation 33 & 52 read with Regulation 47(1) of the SEBI (Listing Obligations

and Disclosure Requirements) Regulations, 2015.

### DEDICATED FREIGHT CORRIDOR CORPORATION OF INDIA LTD. (A Government of India (Ministry of Railways) Enterprise)

### **Notice for Request for Proposal**

HQEN-TEC-RGM-RIV-OM-12Y/33092R Name of Work: Operation & Maintenance of DFCCIL's RGM Formation and RIV Machine including supply of spares and other items for 12 years within DFCCIL Network." [RFP Doc. No. DFC/CO/EN/TECH/RGM-RIV/0&M/12YRS/33092R Dated 23.05.2025]

DFCCIL invites open E-Tenders/offers on Single Stage Two Packet System on prescribed forms from firms/Companies / Joint Ventures having requisite technical experience and financial capacity for undertaking of the captioned project (through IREPS). The complete RFP document bearing same eference number & containing requisite instructions / information for RFP/bid submission, have been uploaded on IREPS website www.ireps.gov.in and DFCCIL website dfccil.com for downloading from 23.05.2025. Amendment/ Modification in RFP, if any, will be uploaded on the

Bidders will be able to submit their original/revised RFP/Bid up to closing date Closing Date/Time: 26/06/2025; 15:00 Hrs.

### ASSAM POWER GENERATION CORPORATION LIMITED

### **NOTICE INVITING TENDER**

E-Tenders are invited from the intending contractors/firms/suppliers for execution of "Major Overhauling of Unit No-2, 1.5 MW, Francis Type Gugler make Hydro Turbine of Myntriang Small Hydro Electric Project (MSHEP) Stage-II, APGCL, Lengery, Karbi Anglong." required n Assam Power Generation Corporation Limited under the Department of Power, Govt. of Assam. The Tender documents can be nloaded from the E-tender portal https://assamtenders.gov.in

- The last date of submission of tender document is on
- 16-06-2025 (12:00 Hrs)
- The bids will be opened online on E-tender portal on 17-06-2025 (12:00 Hrs)

The TIA reserves the right to accept or reject any bid/tender, and to cancel/annul the bidding process and reject all bids at any time prior to

Name of the TIA: Chief General Manager (Gen), APGCL Address of the TIA: 3rd Floor Bijulee Bhawan, Paltanbazar, Guwahati-1

Sd/- Chief General Manager (Gen) ਨੂੰ APGCL, Bijulee Bhawan, Guwahati -1

### **HITECH CORPORATION LIMITED**

Lower Parel (West), Mumbai - 400 013

NOTICE (For the attention of the Equity Shareholders of the Company) TRANSFER OF EQUITY SHARES TO THE INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)

his Notice is published pursuant to the provisions of Investor Education and Protection und Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the IEPF Rules"

and amendments thereto. Members are hereby informed that in terms of Section 124(6) of the Companies Act, 2013 and the IEPF Rules, all equity shares, in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more, are liable to be transferred by the Compan

to the demat account of Investor Education and Protection Fund (IEPF).

he Company has sent a communication to the concerned shareholders at their registered address, interalia, providing the details of their unclaimed dividend and giving them an opportunity to claim the said unclaimed dividend, latest by **Thursday**, 31<sup>st</sup> **July**, 2025, to avoid transfer of their shares to the Demat Account of the IEPF Authority.

In terms of Rule 6 of IEPF Rules, a statement containing details of the name(s) of the shareholder(s) and their Folio number / DP ID-Client ID whose shares are liable to be ransferred to the Demat Account of IEPF Authority is available on our websit www.hitechcorporation.co for information and necessary action by the shareholder(s).
The concerned Members are requested to claim such unpaid/unclaimed dividend by

sending a letter quoting their Folio No./ DP ID-Client ID, under their signature, to the Company's Registrar & Share Transfer Agent – M/s MUFG Intime India Private Limited (Formerly Link Intime India Private Limited, at their address mentioned below, to issue duplicate dividend warrant.

n case no valid claim in respect of such equity shares is received from the shareholders by 31st July, 2025, the said equity shares shall be transferred to the Demat Account of IEPF Authority as per the procedure stipulated under the IEPF Rules. In this connection, pleas

- For shares held in physical form: New share certificate(s) will be issued and transferred subsequently to the Demat Account of the IEPF Authority without any further notice. Further, upon issue of such new share certificate(s) the original share certificates(s) which are registered in your name will stand automatically cancelled and deemed to be
- For Shares held in electronic form: The shares will be directly transferred to the Demai Account of the IEPF Authority with the help of Depository Participants(s) without any

t may be noted that no claim shall lie against the Company in respect of unclaimed dividend and shares transferred to IEPF pursuant to IEPF Rules. Upon transfer to the Demat Account of the IEPF Authority, the shareholders can claim the equity shares along with the dividend(s) from the IEPF Authority by making an online application for which the details are available at www.iepf.gov.in. Clarification on this matter, if required, may be sought from the Company's Registrar an

Share Transfer Agent by writing to them quoting their Folio No./ DP ID-Client ID at; MUFG Intime India Private Limited (Formerly Link Intime India Private Limited, (Unit: Hitech Corporation Ltd.), C - 101, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400 083; Tel. 022 – 4918 6000; E-mail: <a href="mailto:iepf.shares@in.mpms.mufg.com">iepf.shares@in.mpms.mufg.com</a>
For Hitech Corporation Limited

Hetali Mehta **Company Secretary** 

### **RESONANCE SPECIALTIES LIMITED**

Regd. Office: Plot No. 54-D, Kandivli Industrial Estate, Kandivli West, Mumbai-400067. Phone: 022-6210 6053

Email Id: investors@resonancesl.com
Website: www.resonancesl.com CIN: L25209MH1989PLC051993

### NOTICE

NOTICE is hereby given that the Company has on May 23, 2025 completed the electronic dispatch of the Postal Ballot Notice under the provisions of Section 110 of the Companies Act, 2013, to the Members whose names appear in the Register of Members/Beneficial owners as on the cut-off date i.e. May 21, 2025 seeking assent / dissent of the Members through Postal Ballot only through e-voting for the following Special Resolutions to be passed as per the postal ballot notice dated May 19, 2025

- Re-appointment of Mr. Ajay Anantrai Patadia (DIN: 00298226) as an Independen Director of the Company.
- Re-appointment of Mr. Rai Kamal Prasad Verma (DIN: 02166789) as an Independent Director of the Company.

The Postal Ballot Notice is also available on the Company's website www.resonancesl.com and website of National Securities Depository Limited (NSDL) Adroit Corporate Services Pvt Ltd, <u>www.evoting.nsdl.com</u>. These details are also available on the website of the Stock Exchange where the shares of the Company is listed: BSE Limited (www.bseindia.com). n compliance with the provisions of Sections 108 and 110 of the Act and Rules 20 and

22 of the Companies (Management and Administration) Rules, 2014 as amended ("Rules") and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended, the Company is pleased to provide voting by electronic means ("e-voting") facility to the Members, to enable them to cast their votes electronically. The Company has engaged the services of National Securities Depository Limited (NSDL) to provide e-voting facility to its Members.

The e-voting period commences from 9.00 a.m. (IST) on Sunday, May 25, 2025 and ends at 5.00 p.m. (IST) on Monday, June 23, 2025. During this period, Members holding shares either in physical form or in dematerialized form, as on Monday, May 21, 2025 i.e. cut-off date, may cast their vote electronically. The e-voting module shall be disabled by NSDL for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, he, she shall not be allowed to change it subsequently or cast vote again. Voting rights will be reckoned on the paid-up value of Equity Shares registered in the name of the Members on Wednesday, May 21, 2025. For details relating to e-voting, please refer to the Postal Ballot Notice. In case of any

gueries, you may refer the Frequently Asked Questions (FAQs) for shareholders and e voting user manual for shareholders available at <u>www.evoting.nsdl.com</u>or call on No 02248867000 or send a request at evoting@nsdl.com. In case of any grievances connected with facility for voting by electronic means, please contact Mr. Sanjee Yadav, NSDL, at evoting@nsdl. com.

The results of the Postal Ballot will be announced on Tuesday, June 24, 2025. The said results would be displayed on the notice board at the registered office of the Compan and intimated to BSE Limited where the shares of the Company are listed. Additionally the results will also be uploaded on the Company's website www.resonancesl.com and on the website of NSDL at www.evoting.nsdl.com.

By order of the Board For Resonance Specialties Limited Vaibhavi Rajeshirke Company Secretary & Compliances Office

Place:Mumbai

Place: Waghodia

**Date**: May 23, 2025

### **EVEREST KANTO CYLINDER LIMITED**

Clean Energy Solution Company

### Reliable partner for Quality & Safety since 1978....



### STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE OUARTER AND YEAR ENDED 31st MARCH. 2025

(₹ in Lakhs, unless otherwise stated)

Particulars	3 Months Ended	Preceding 3 Months Ended	Corresponing 3 Months Ended in the Previous Year	Year to date figures for Current Period Ended	Previous Year Ended	
	31-03-2025	31-12-2024	31-03-2024	31-03-2025		
	(Refer Note 3)	(Unaudited)	(Refer Note 3)	(Audited)	(Audited)	
Total Income from Operations	42,440	36,939	32,646	1,50,906	1,22,967	
Net Profit for the period before Tax, Exceptional Items	2,571	2,723	1,873	13,041	12,034	
Net Profit for the period before Tax after Exceptional Items	1,923	2,723	1,656	12,393	11,817	
Net Profit for the period after Tax	1,327	1,796	1,311	9,772	9,760	
Equity Share Capital	2,244	2,244	2,244	2,244	2,244	
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	1	•	-	1,18,396	1,07,813	
Basic and diluted earnings per equity share (face value of Rs. 2 each) (not annualised, except for year end) (in Rs.)	1.19	1.61	1.29	8.73	8.84	

Place: Mumbai

Date: 23rd May, 2025

- 1) The above is an extract of the Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full format of the aforesaid Financial Results is available on the websites of the Stock Exchanges (www.bseindia.com and www.nseindia.com) and on the website of the Company (www.everestkanto.com) under Investors section.
- 2) The above unaudited financial results are reviewed by the Audit Committee and were approved and taken on record by the Board of Directors at its meeting held on 23 May, 2025. The same can be accessed by scanning the QR Code Provided.
- 3) The figures for the quarter ended 31st March, 2025 and 31st March, 2024 represent the balancing figures between audited figures in respect of full financial year and those published till the third quarter of the respective financial year, which were subjected to limited review by Statutory Auditors.



By the Order of the Board For, Everest Kanto Cylinder Limited

**Puneet Khurana Managing Director** DIN: 00004074

### **EVEREST KANTO CYLINDER LIMITED**

Registered Office: 204, Raheja Centre, Free Press Journal Marg, 214, Nariman Point, Mumbai - 400021. CIN: L29200MH1978PLC020434 • Website: www.everestkanto.com Tel. Nos.: 022-4926 8300 / 01 • Fax: 022-49268354 • Email: investors@ekc.ir



CIN: L24231TN1958PLC003647 Website: www.ttkhealthcare.com

### EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE **FOURTH QUARTER AND YEAR ENDED MARCH 31, 2025**

(Rs. in lakhs)

I .		Foi	the Quarter end	For the year ended			
SI. No.	Particulars	(31/03/2025) (31/12/2024) (31/03/2024		(31/03/2024)	(31/03/2025)	(31/03/2024)	
		Audited	Unaudited	Audited	Audited	Audited	
1.	Total income from Operations	19,035.96	20,474.48	18,105.63	80,149.34	75,279.38	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	2,761.99	2,259.35	2,422.63	9,442.52	8,412.03	
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary Items)	2,175.60	2,259.35	2,422.63	10,833.18	8,412.03	
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary Items)	1,614.83	1,673.24	1,827.20	8,165.69	6,284.19	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	1,052.27	1,575.21	1,627.14	7,825.96	6,166.51	
6	Equity Share Capital (Face Value of Rs.10/- per share)	1,413.03	1,413.03	1,413.03	1,413.03	1,413.03	
7	Other Equity as per Balance Sheet of previous accounting year (excluding Revaluation Reserve)				104,650.36	98,237.43	
8	Earnings per share (of Rs.10/- each) (for continuing and discontinued operations)						
	(a) Basic (in Rs.)	11.43	11.84	12.93	57.79	44.47	
	(b) Diluted (in Rs.)	11.43	11.84	12.93	57.79	44.47	

### Notes:

Place : Chennai

Date: May 23. 2025

- The above is an extract of the detailed Statement of Audited Financial Results for the Fourth Quarter and Year ended March 31, 2025, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- The full financial results for the Fourth Quarter and Year ended March 31, 2025 are available on the website of BSE Limited (www.bseindia.com) National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.ttkhealthcare.com)
- These financial results have been reviewed by the Audit Committee at its meeting held on May 22, 2025 and approved by the Board of Directors of the Company at its meeting held on May 23, 2025 at the Registered Office of the Company, also with the provision of Video Conferencing facility. The Statutory Auditors have audited the above results and have issued an unmodified opinion.
- During the First Quarter of this financial year, the Company had sold Leasehold land with building at Mahindra World City, Chennai for a consideration of Rs.2,300 lakhs and the profit on sale amounting to Rs.1,977.05 lakhs (Net) has been considered in the above results.
- During the Fourth Quarter of this financial year, the Company has written off the entire value of Male Contraceptives pertaining to the Protective Devices Division amounting to Rs.586.39 lakhs that were meant for export under USAID Program, owing to a 90-day pause on foreign development assistance and subsequent cancellation of Purchase Orders as the inventory was custom-made and not marketable to alternate buyers
- Implementation of the Code of Social Security 2020, which is likely to impact the contributions by the Company towards Provident Fund, Gratuity and other related areas has been deferred by the Government beyond April 01, 2021. However, the Company based on the initial assessment made a provision for Rs.350 Lakhs in the Fourth Quarter of FY 2020-21 and proposes to take further appropriate action after the Rules are made applicable.
- The Board has recommended a dividend of Rs.10/- (100%) per Equity Share of Rs.10/- each for the financial year ended March 31, 2025
- The figures for the Quarter ended March 31, 2025 and March 31, 2024 are the balancing figures between the Audited Figures in respect of the full financial year and the published year to date figures upto the end of the Third Quarter of the relevant financial year which were subjected to Limited
- 9. The previous period's / year's figures have been regrouped and reclassified, wherever necessary to conform to the current period's / year's presentation.



For TTK HEALTHCARE LIMITED T T RAGHUNATHAN **Executive Chairman** 

સ્થાનિક આદિવાસીઓમાં નિગમના સત્તાધીશો સામે રોષ

## સામા ચોમાસે નર્મદા નિગમે આદિવાસીઓના ઘર-દુકાનો તોડ્યા યોગ્ય નથી: મનસુખ વસાવા

એસઓચું સામે દુકાનો અને ઘરો તોડી પાડ્યા મુદ્દે મનસુખ વસાવાનો સીએમને પત્ર

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે

આદિવાસીઓની દુકાનો અને ઘરો સ્ટેચ્યું ઓફ યુનિટીને લીધે પ્રત્યક્ષ વચ્ચે રાખવાના હતા.

તોડી પાડવા મુદ્દે સ્થાનિક ભાજપના અને પરોક્ષ રીતે લોકોને રોજગાર નેતાઓએ મને મળી રજૂઆત કરી પણ મળે છે.લોકો દુઃખી ન થાય એ સ્થાનિક આદિવાસીઓની ૩૪ છે.વહીવટીતંત્ર દ્વારા ચોમાસાના માટે સરકારે ચોમાસાને ધ્યાનમાં જેટલી દુકાનો તથા ૭ થી ૮ જેટલા એક માસ પુર્વે આ ડિમોલેશન કર્યું રાખીને પતરાના શેડ બનાવી ઘરો નર્મદા નિગમ દ્વારા તોડી એ બિલકુલ યોગ્ય નથી. સ્થાનિક આપવા જોઈએ, રોજગારી રાબેતા પડાતા સ્થાનિક આદિવાસીઓ રોષે આદિવાસીઓના પ્રશ્નોની રજુઆત મુજબ ચાલે એની કોઈ વ્યવસ્થા ભરાયા છે.એક તરફ ડેડિયાપાડાના મને તથ્ય જણાય છે.આ બાબતે કરવી જોઈએ. આમને ૪૫ દિવસ ધારાસભ્ય ચૈતર વસાવાએ આ તમારી કક્ષાએથી આદિવાસીઓના પેહલા નોટીશ આપી ત્યારે ચૈતર મુદ્દે આંદોલન છેડ્યું તો બીજી પ્રશ્નોના સમયસર ઉકેલ માટે વસાવાએ આ મુદ્દો ન ઉઠાવ્યો અને બાજુ ભાજપ સાંસદ મનસુખ મિટિંગ બોલાવવી જોઈએ.આ ઘરો તોડ્યા પછી આ મુદ્દો ઉઠાવ્યો વસાવાએ આ મામલે વિરોધ પ્રશ્નો બાબતે નર્મદા જિલ્લાના છે.ચૈતર વસાવા એન્ડ કંપની નોંધાવી ગુજરાતના મુખ્યમંત્રી બીજા પણ પદાધિકારીઓને રૂબરૂ માત્ર રાજકીય લાભ માટે આવું ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોતાની મળી ચર્ચાઓ કરવી જોઈએ. કરે છે, આદિવાસીઓના પ્રશ્નોનો રજુઆત કરી છે.ભાજપ સાંસદ જિલ્લાના સ્થાનિક આગેવાનોની ઉકેલ આવે એ દિશામાં વિચારતા મનસુખ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર તમારા લેવલે બેઠક બોલાવી યોગ્ય નથી.નર્મદા નિગમે નોટીશ આપ્યા પટેલને લખેલા પત્રમાં જણાવ્યું ઉકેલ લાવવો જોઈએ.આ બાબતે પછી ડિમોલેશન કરતા પેહલા આના જોયુ તો તેમાં ગેરકાયદેસર રીતે ભરેલી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઉકેલ માટે સ્થાનિક આગેવાનાને ૧૭ જેટલી ભેંસો જણાવી આવી હતી.

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી સાગબારા પોલીસે પશુ ભરેલા કન્ટેનર ઝડપી પાડી રૂપિયા ૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાગબારા પોલીસે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતા ૧૭ પશુ ભરેલા કન્ટેનરને ઝડપી પાડી પશુઓ અને કન્ટેનર સહિત ૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૨ ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે.નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ ગેર કાયદેસર રીતે પશુઓની થતી હેરાફેરીની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવાની પોલીસને સુચના આપી છે.સાગબારા ઈન્ચાર્જ પીઆઈ સી.ડી.પટેલ મળેલી ચોક્કસ બાતમીને આધારે ધનસેરા ચેકપોસ્ટ પર ચેકીંગ કરી રહ્યા હતા.દરમિયાન ધનસેરા ચેકપોસ્ટ પર નાકાબંધી દરમિયાન એક બંધ બોડીના કન્ટેનર આવતું જોઈ પોલીસે રોકી પૂછપરછ કરી હતી. શંકાસ્પદ જણાતા કન્ટેનર ખોલીને



લઈ જવાના ઇરાદે ગુજરાત માંથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાતા હોવાનું બહાર આવ્યું હતું.બાદ પોલીસે ભરૂચના સીતપોણ મદનીનગરમાં રહેતા સબ્બીરવલી ગની અને વડોદરા કરજણના વલણ અલ્કાપુરી ગામના ઈશાક મુસા બંદુકીયાને ઝડપી પાડ્યા હતા.જ્યારે એમની પૂછપરછ દરમ્યાન તેમની સાથેનો ભરૂચ આમોદના આછોદ ભીખા ખડકીના રહીશ સરફરાજ ઉર્ફે મીથુન મુસા પટેલ ત્યાંથી ભાગી ગયો હતો.સાગબારા પોલીસે આ ત્રણેવના વિરુદ્ધમાં ગુનો પૂછતાછમાં આ પશુઓ કતલ ખાને નોંધી તપાસ હાથ ધરી છે.

આમોદમાં કાછીચાવાડ ખાતે હરિપ્રબોધમ પ્રાર્થના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાચો

## પ્રબોધજીવન સ્વામીની ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઇ

આમોદમાં કાછીયાવાડ ખાતે આવેલા નૂતન હરિપ્રબોધમ પ્રાર્થનાં મંદિર ખાતે સંતોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પરિવારોમાં સંસ્કારોનું સિંચન થાય અને યુવાનો નિર્વ્યસની બની તેમનામાં ધાર્મિકતા પ્રગટે તેવા સંકલ્પને સાકાર કરવા પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવસ્વામીજી નવનિર્મિત હરિ પ્રબોધમ પ્રાર્થનાં હોલમાં ઠાકોરજી તેમજ ગુરુ મહારાજોની મૂર્તિ પ્રતિષ્ઠા



ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીના કરવામાં આવ્યુ હતું. જેમા પ્રાદેશિક સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન સંત ચિંતનસ્વામીના હસ્તે મહાપુજાનું બાદ રાત્રીના આઠ કલાકે ઉત્સવ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રસંગે પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધ જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર જીવનસ્વામીજીએ ખાસ ઉપસ્થિત રહી રહી સંતોના વક્તવ્યને ધ્યાનપુર્વક મહોત્સવનું ધામધૂમથી આયોજન સૌ ભકતોને આશિર્વાદ આપ્યાં હતાં. સાંભળી જીવન ઉપયોગી બનાવ્યું હતું.

केनरा बैंक Canara Bank 📣 डेनेरा બेंड -भां४લपुर शाजा

ગ્રાઉન્ડ ફલોર, દુકાન નં. ૧ અને ૨ ડ્રિમ આઇકન, રમેશ પટેલ ફાર્મ પાસે પાટીદાર કોમ્પ્લેક્સ, ન્યુ આઈપી રોડ, માંજલપુર ભારત, વડોદરા,૩૯૦૦૧૧

Sभा*न*5

વિષયઃ સીક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસ્ટેટ એન્ડ એન્ફોસમેન્ટ ઓફ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૨) ઠેઠળ ડિમાન્ડ નોટીસ કરજદારોએ અમારી બેંક પાસેથી સમચાંતરે નીચેની લોન/ક્રેડિટ સુવિધાઓનો લાભ લીધો છેઃ

શાખા અને કરજદાર નું	ગીરવે મુકેલ મિલકતનું વર્ણન	ડીમાન્ડ	લોનની	હેણાની રકમ
નામ - સરનામું		નોટીસ તારીખ	રક્રમ	લ્હેણાની રકમ
	તમામ ભાગ અને હિસ્સો સ્થાવર મિલકત નો રહેણાંક ઘર નં. બી-ક/ર૧૨, રજો માળ ક્ષેત્રફળ ૩૯.૨૯ ચોરસ મીટર બિલ્ટઅપ એરીચા જે 'ખટંબા અર્બન રેસીડેન્સી-૧' તરીકે ઓળખાય છે , ટાવર-બી PMAY EWS-2, ખટંબા ફોરટ અને જમીન પર બાંધકામ અને આવેલ તે ગામ ખટંબા ની સીમ નો બ્લોક નં. પર/એ પૈકી અને હહ પૈકી વડોદરા. ચતુર્સીમાં ઉત્તર: કોમન દાદાર, દક્ષિણા ઘર નં. બીક/૨૦૭, પશ્ચિમઃ હ.૫૦ મીટર નો રસ્તો.	રર.૦૫.૨૦૨૫ એનપીએ તારીખ ૨૦.૦૫.૨૦૨૫	Housing Loan- Ready Built Loan No. 70639330000015 ફ્રા. ૪,૪૦,૦૦૦.૦૦ મંજુર થયેલ તારીખ ૨૦.૦૯.૨૦૧૯ વ્યાજનો દર ૯%	વ્યાજ સાથે કુલ બાકી રૂા. ૪,૧૨,૦૪૪.૯૨

ઉપરોક્ત લોન/ક્રેકિટ સવલતો અહીં આપેલા શેડ્યૂલમાં વધુ વિશિષ્ટ રીતે વહવિલ અસ્કથામતોના મોર્ટગેજર દ્વારા, તમારા દ્વારા અમારી તરફેણમાં અમલમાં મૂકાચેલા સંબંધિત દસ્તાવેજોના આધારે યોગ્ય રીતે સુરક્ષિત છે. તમે નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર તમારી જવાબદારીઓનું નિકાલ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, બેંકે ઉપર મુજબ દેવું એનપીએ તરીકે વર્ગી કૃત કર્યું છે.

આથી, અમે તમને વિષય અધિનિયમની કલમ ૧૩(૨) દેઠળ આ નોટિસ જારી કરીએ છીએ અને તમને ઉપરોક્ત રૂા. ૪,૧૨,૦૪૪.૯૨ ની સમગ્ર જવાબદારી ઉપાર્જિત અને અપ–ટુ–કેટ વ્યાજ અને અન્ય ખર્ચાઓ સાથે, તારીખથી સાઠ દિવસની અંદર કિસ્ચાર્જ કરવા માટે આહ્વાન કરીએ છીએ. નોટિસ, જેમાં નિષ્ફળ થવા પર અમે વિષય અધિનિયમની કલમ ૧૩(૪) હેઠળના તમામ અથવા કોઈપણ અધિકારોનો ઉપયોગ કરીશું. વધુમાં, તમે અમારી પૂર્વ સંમતિ વિના, કોઈપણ રીતે, શેડ્યૂલમાં ઉદ્દોખિત કોઈપણ સુરક્ષિત સંપત્તિઓ સાથે વ્યવહાર કરવા માટે આથી પ્રતિબંધિત છો. આ વિષય અધિનિયમ અને/અથવા અમલમાં રહેલા અન્ય ક્રોઈપણ કાયદા હેઠળ અમને ઉપલબ્ધ ક્રોઈપણ અન્ય અધિકારો માટે

સિકચોર્ડ મિલકત છોડાવવા ઉપલબ્ધ સમય બાબતે ઉક્ત એક્ટના સેકશન ૧૩ ના સબ–સેકશન (૮)ની જોગવાઈ તરફ તમારૂ ધ્યાન દોરવામાં

બ્રાન્ચના રેકોર્ડમાં ઉપલબ્ધ તમારા છેદા! જાણીતા સરનામાને કારણે રજિસ્ટર્ડ પોસ્ટ Ack દ્વારા તમને ડિમાન્ડ નોટિસ પણ આપવામાં આવી હતી.

નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે. તા.: ૨૪.૦૫.૨૦૨૫– સ્થળઃ વડોદરા

### Panchmahal Steel Limited

Registered Office: GIDC Industrial Estate, Kalol-389 330, Dist. Panchmahals, Gujarat. CIN: L27104GJ1972PLC002153, Phone No.: 02676-230777, Fax No.: 02676-230889 Email: shares@panchmahalsteel.co.in, Website: www.panchmahalsteel.co.in EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE

QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

**Quarter Ended** Year Ended As at As at 31st 31st March, December, 31st March 31st March 31st March 2025 2024 2024 2025 2024 (Audited) (Audited) (Audited) Unaudited (Audited) Total Revenue 9,176.86 9,525.21 9,957.26 38,581.40 43,186.14 Net Profit / (Loss) for the period 223,49 324.54 455.71 (270.27)391.88 (before Tax, Exceptional and/or Extraordinary items) 324.54 455.71 391.88 223.49 (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after Tax 244.47 (202.93)166.14 332.53 296.92 (after Exceptional and/or Extraordinary items) [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] **Equity Share Capital** 1,907.83 1,907.83 1,907.83 1,907.83 Reserves excluding Revaluation Reserve as shown 14121.93 13781.06 in the Audited Balance Sheet of the previous year (Other Equity) i.e. as at 31.03.2025 Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) a) Basic (1.06)0.87 1.28 1.74 1.56 1.28 1.74 b) Diluted (1.06)0.87 1.56

The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results for the quarter and year ended on 31st March, 2025 are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in.

Place: Vadodara Date : 23rd May 2025 Scan here for Result

By order of the Board Ashok Malhotra Chairman & Managing Director DIN - 00120198

(Rs. in Lakhs

## MIT

CIN: L99999GJ1987PLC009768

Regd. Office: 9-10, GIDC Industrial Estate, Waghodia - 391 760. Dist.: Vadodara Ph.: 75748 06350 E-mail: co secretary@20microns.com Website: www.20microns.com

Statement of Audited Financial Results (Standalone and Consolidated) for the Quarter and Year Ended March 31, 2025

The Board of Directors of the Company, at its meeting held on May 23, 2025, approved the Audited Financial Results (Standalone and Consolidated) of the Company for the quarter and year ended March 31, 2025 ("Financial Results").

The Financial Results have been posted on the Company's website and are accessible at: https://www.20microns.com/financial-result

You may also access the results by scanning the QR code below:



For and on behalf of the Board of Directors 20 Microns Limited

> Rajesh C. Parikh **Chairman & Managing Director** DIN: 00041610

Note: This intimation is made pursuant to Regulation 33 & 52 read with Regulation 47(1) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

નવું કમિશન પગાર અને પેન્શનમાં ગોઠવણોનું મૂલ્યાંકન કરશે : કર્મીઓ-પેન્શનરોને લાભ થશે

# ૧ જાન્યુઆરીથી ૮મું પગારપંચ લાગુ થશે

### ફિટમેન્ટ ફેક્ટર અને લઘુતમ પગાર ધોરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે : ભથ્થામાં સુધારો કરાશે

નવી દિલ્હી, તા.૨૩

આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૬ એ તારીખ છે જ્યારે ૮મું પગાર પંચ લાગુ થવાનું છે. આ નવા પગારપંચને કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં મંજૂરી આપી હતી. દેશના ૫૦ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ ૬૫ લાખ પેન્શનરોને આનો લાભ મળવાની અપેક્ષા છે.

૮મા પગારપંચની રાહ જોતા કર્મચારીઓ ખુશ થયા. ૮મા પગાર 🛮 જોઈ રહ્યા છે. પંચ હેઠળ કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારો કરવામાં આવશે. નવું કમિશન શરતો પ્રકાશિત કરી નથી. બજેટ પગાર અને પેન્શનમાં ગોઠવણનું ૨૦૨૫ માં કરદાતાઓ માટે ઘણી મૂલ્યાંકન કરશે. આ દરમિયાન દરખાસ્ત કરવામાં આવી હોવા ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ પગાર છતાં, બજેટ દસ્તાવેજોમાં ૮મા ધોરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પગાર પંચના અમલીકરણમાં કેન્દ્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. લાખો સરકારને થનારા ખર્ચનો ઉલ્લેખ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો ૮મા નથી. પગાર પંચના અમલીકરણની રાહ

માટે કહેવામાં આવ્યં છે.

નોર્થર્ન આર્ક કેપિટલ લિમિટેડ

N®RTHERN નોંધણી થયેલ એફિસઃ ૧૦મો માળ, ફેઝ-૧, આઈઆઈટી-મદ્રાસ રિસર્ચ પાર્ક, ARC કનાગામ ગામ, તારામણી, ચેત્રાઈ - ૬૦૦૧૧૩, તમિલનાડુ.

જ્યારે, સિક્ચોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ

ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડેના અધિકૃત અધિકારી

તરીકે અને સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વાંચવામાં આવેલી

કલમ ૧૩ (૧૨) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને**. ૧૩ જાગ્યઆરી ૨૦૨૫** ના રોજ માંગણા

સુચના જારી કરી, જેમાં ઉધાર લેનાર અને સહ-ઉધાર લેનાર (૧) શ્ર**ી અજામ રસુલભાઇ મિર્ઝા (૨)** 

શ્રીમતી જેતુનબીબી મિઝાં, (૩) શ્રી રસુલભાઈ મોહમ્મદભાઈ મિઝાં ઘર નંબર એફ-૬, સુબેદાર

દેનામેન્ટ, એકોટા પોલીસ લાઈન સામે એકોટા, વડોદરા, ગુજરાત - ૩૯૦૦૨૦ ખાતે સરનામું છે

ને ૯ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ નોટિસમાં ઉલ્લેખિત ૨કમ રૂ. ૨૪,૪૮,૦૩૮.७૩ (રૂપિયા ચોવીસ લાખ અડતાળીસ હજાર આડત્રીસ અને તોત્તેર પૈસા માત્ર) વ્યાજ સાથે દ૦ દિવસની અંદર ચુકવવા

ઋણ લેનાર ૨કમ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, ઋણ લેનાર/જામીનદાર/સહ ઋણ લેનાર અને

સામાન્ય જનતાને સૂચના આપવામાં આવે છે કે નીચે સહી કરનારે **૨૨ મે ૨૦૨૫** ના રોજ આ કબજા

સૂચના પર ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૪) સાથે વાંચવામાં આવેલા નિયમોના નિયમ ૮ હેઠળ તેમને/

ઋણ લેનાર/જામીનદાર/સહ-ઋણ લેનાર અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે

તેઓ મિલકત સાથે વ્યવહાર ન કરે અને મિલકત સાથેના કોઈપણ વ્યવહાર માટે **૯ જાવ્યુઆરી, ૨૦૨૫** 

ના રોજ INR ૨૪,૪૮,૦૩૮.७૩ (રૂપિયા ચોવીસ લાખ અડતાળીસ હજાર આડગ્રીસ અને તોત્તેર

**પૈસા માત્ર)** નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડને આધિન રહેશે, જે તેના પર ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

સ્થાવર મિલકતનું વર્ણન

તે તમામ મિલકતના ટુકડા અને ભાગ, સ્થાવર મિલકતમાં સ્થિત છે, જેમાં મકાન નં. F/06, પ્લોટ

માપણી વિસ્તાર ૧૦૦૦.૦૦ ચોરસ ફૂટ એટલે કે ૯૨.૯૦ ચોરસ મીટર, બિલ્ટ અપ માપણી વિસ્તાર

૭૦૦.૦૦ ચોરસ ફૂટ, એટલે કે ૬૫.૦૩ ચોરસ મીટર, "સુબેદાર ચેમ્બર" તરીકે ઓળખાતી યોજનામાં

રેવન્યુ સર્વે નંબર ૪૭૦ અને ૪૭૪/૧ પૈકી, શીટ નંબર ૪૭, સિટી સર્વે નંબર ૪૧૨૫, મીટર મોજે

વડોદરા કરબા, નોંધણી સબ જિલ્લો - વડોદરા ગુજરાતમાં સ્થિત છે. સીમાઓઃ- **ઉત્તરઃ**- મકાન નં. F/૬

ઈન્ડિયન બેંક - સચાજીગંજ શાખા

પેકહિલ બિઝનેસ હબ, ડેરી ડેન સર્કલ પાસે,

ષ્ટ -IV નિયમ - ૮(૧) **કબજા અંગેની નોટિસ (**સ્થાવર મિલ્કત માટે)

નીચે સહી કરનાર સીક્યુરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટ્સ એન્ડ

એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ નો हેઠળ તે કલમ ૧૩(૧૨) ના નિયમ–૩

ની સાથે વાંચતા સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ મળેલા અધિકારો હેઠળ

સથાજીગંજ શાખા, ના અધિકૃત અધિકારીની રૂઇએ નીચે જણાવેલ બાકી કરજદાર શ્રી દિપક ડી

<mark>जानानी, શ્રીમતી સુશીલા કી ખાનાની, મિસ નિકિતા કી ખાનાની</mark> ને ડીમાન્ડ નોટીસ પાઠવીને નોટીસ માં બાકી ખાતેદાર સામે દર્શાવેલી રકમ **રૂા. ૩૦,૧૨,૧૦૯**/- **(રૂા.ત્રીસ લાખ** 

<mark>બાર હજાર એકસો નવ પુરા)</mark> અને નોટિસમાં દર્શાવેલ વ્યાજ સાથે નોટિસ મળ્યાની તારીખથી

તમો કરજદાર નીચે જણાવેલી રકમોની પરત ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, આ સાથે

બાકી કરજદાર અને સામાન્ય જનતા ને જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે ઉપર જણાવેલ

નીયમોના સીક્યુરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ ૨૦૦૨ ના નિયમ ૮ ને સબંધીત પેટા કલમ

(૪) ની કલમ ૧૩ની સાથે વાંચતા પ્રાપ્ત થતી સત્તાઓ અનુસાર મિલકતનો **સાંકેતિક કબજો** 

તમો કરજદાર તથા સામાન્ય સંદર્ભમાં જાહેરજનતાને અત્રે નીચે જણાવેલી અનુસુચિત

મેલકતની બાબતમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કે લેવડ દેવડ ન કરવા ચેતવણી આપવામાં

આવે છે, ઇન્ડિયન બેંક ની બાકી લેણા ૨૬મ રૂા. ૩૦,૧૨,૧૦૯/- (રૂા.ત્રીસ લાખ બાર હજાર

અમો ગીરવે રાખેલ અસ્ક્યામતો આપેલા સમય માં છોડવવા અંગે કરજદારો નુ સરફેસી કાયદાની

અથલ સંપતી નું વર્ણન

તમામ ભાગ અને ફિસ્સો રહેણાંક ઘર આવેલ તે ફલેટ નં. ૨૦૧, બ્લોક નં. સી–૩, રજો માળ,

રહેણાંક સ્કીમ 'રાજેશ્વર ગોલ્ક' નામે નો ફલેટ એરીચા ૧૭૮૦ ચોરસ મીચર અને સુપર બિલ્ટઅપ એરીયા ક્ષેત્રફળ ૧૬૫.૪૨ ચોરસ મીટર નો રેવન્યુ સર્વે નં. ૧૦૬૫ નુ માપન એરીયા

૪૦૪७ ચોરસ મીટર અને આર.એસ. નં. ૧૦૬७ ના એરીયાનું ક્ષેત્રફળ ૩૬૪૨ ચોરસ મીટર

અને આર.એસ. નં. ૧૦૬૯ ન એરીયા ક્ષેત્રફળ ૬૨७૩ ચોરસ મીટર કુલ એરીયા ક્ષેત્રફળ

૧૩૯૬૨ ચોરસ મીટર નો રજીસ્ટ્રેશન જીલ્લો સબ જીલ્લો વડોદરા–૫ (બાપોદ) ગામ હરણી,

વડોદરા. ચતુર્સીમાઃ પૂર્વઃ ફલેટ ૨૦૨, પશ્ચિમઃ ઓપન સ્પેસ, ઉત્તરઃ ઓપન સ્પેસ, દક્ષિણ

**દક્ષિણ:** - મકાન નં. F/7 પૂર્વઃ - સોસાયટી રોડ પશ્ચિમઃ - કોમન પ્લોટ

૬૦ દિવસની અંદર ચુકવણી કરવા જણાવ્યુ હતુ.

તા.૨૦.૦૫.૨૦૨૫ ના રોજ લઇ લધો છે.

**એકસો નવ પુરા**) અને તેના પર ના વ્યાજ સહિત.

કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

તા.: ૨૦.૦૫.૨૦૨૫ નોંધ: વિવાદની સ્થિતિમાં આ નોટીસનો

થળઃ વડોદરા

વકોદરા-૩૯૦૦૦૫

તેણીને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને નીચે વર્ણવેલ મિલકતનો કબજો લીધો છે.



ઉલ્લેખનીય છે કે સરકારે હજુ સુધી ૮મા પગાર પંચ માટે સંદર્ભની

ફિટમેન્ટ ફેક્ટર શું છે ? પગાર

પ્રમાણભૂત ગુણક તરીકે કાર્ય કરે છે. આનાથી કર્મચારીના ગ્રેડ કે પે બેન્ડ પર કોઈ ફરક પડતો નથી. સાતમા પગાર પંચમાં

વધારો થયો હતો. ૨.૫૭ નો ફિટમેન્ટ

સુધી જાહેર કરવામાં આવ્યું નથી, તે આશરે ૨.૫ હોવાનો અંદાજ પંચનું એક મહત્વપૂર્ણ પાસું ફિટમેન્ટ ફેક્ટર છે, જે તમામ સ્તરે પગાર છે. આનાથી પગાર અને પેન્શનમાં અને પેન્શન ફરીથી નક્કી કરવા માટે નોંધપાત્ર વધારો થઈ શકે છે. એટલે

કરવામાં આવ્યો.

કે જો કોઈ કર્મચારીનો પગાર ૪૦ હજાર રૂપિયા છે તો તેનો સંભવિત પગાર એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં, કેન્દ્ર કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર સરકાર ૮મા પગાર પંચ અંગેના ટર્મ ઓફ રેફરન્સ અંગેના નિર્ણયની

આના કારણે કર્મચારીઓનો લઘુતમ

પગાર ૭,૦૦૦ રૂપિયાથી વધીને

સુધારો કરવામાં આવ્યો. જે ૩,૫૦૦

રૂપિયાથી વધારીને ૯,૦૦૦ રૂપિયા

જોકે ૮ મા પગાર પંચ માટે

સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટર હજુ

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ૧૮,૦૦૦ રૂપિયા થયો. તેવી જ કહેવામાં આવ્યું હતું કે TPR ની રીતે, પેન્શનમાં પણ નોંધપાત્ર જાહેરાત માર્ચના અંત સુધીમાં થઈ શકે છે અને નવી પેનલની જાહેરાત એપ્રિલના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે. જોકે, હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. પગાર પંચનું એક મહત્વપૂર્ણ પાસું ફિટમેન્ટ ફેક્ટર છે, જે તમામ સ્તરે પગાર અને પેન્શન ફરીથી નક્કી કરવા માટે પ્રમાણભૂત ગુણક તરીકે કાર્ય કરે છે. આનાથી કર્મચારીના ગ્રેડ કે પે બેન્ડ પર કોઈ ફરક પડતો નથી.

કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. જાહેરાત કરે છે તેના પર ધ્યાન

PSI (પાવર સપ્લાય ઇન્સ્ટોલેશન) સંપત્તિઓની જાળવણી અને અન્ય સહાયક પ્રવૃત્તિઓનું આઉટસોર્સિંગ ન્ડર નંબર EL/TRD/Tender/24-25/18R ભારતના રાષ્ટ્રપતિ વતી અને તેમના માટે ડિવિઝનલ રેલવે મેનેજર (ઈલેક્ટ્રિકલ Tr. D ) પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા - 390 004 નીચેના કામો માટે ટેન્ડર મંગાવવામાં આવે છે.**ટેન્ડર** નંબર: EL/TRD/Tender/24-25/18R કામનું નામ: વડોદરા ડિવિઝનના સુરત-ગેરતપુર, વડોદરા - ગોધરા, ગોધરા-આણંદ અને આણંદ-ખંભાત વિભાગમાં PSI (પાવર સપ્લાય ઇન્સ્ટોલેશન) સંપત્તિઓની જાળવણી અને અન્ય સહાયક પ્રવૃત્તિઓનું આઉટસોર્સિંગ. કામની અંદાજિત કિંમત (રૂ.માં): ₹3,85,58,086/- બિડ સિક્યોરિટી (રૂ.માં): ₹3,42,800/- ટેન્ડર દસ્તાવેજોની કિંમત અને પૂર્ણતાનો સમયગાળો: પૂર્ણ થવાનો સમયગાળો 24 મહિના ટેન્ડર શેડ્યુલ : ટેન્ડર સમાપ્તિ તારીખ 19/06/2025 અને બંધ થવાનો સમય એ જ તારીખે 15-00 કલાકે. વેબ પેજની વિગતો અને સૂચના માટેનું સ્થાન જ્યાં સંપૂર્ણ વિગતો જોઈ શકાય છે અને ઓફિસનું સરનામું અને સ્પષ્ટિકરણ: ડિવિઝનલ રેલવે મેનેજર (ઈલેક્ટ્રિકલ Tr. D) પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા -390 004 વેબ સાઈટ @www.ireps.gov.in

अमने (११८५ इरो: f facebook.com/

Email: secretarial.in@inoxcva.com, Website: www.inoxcva.com વિડિયો કોન્ફરન્સિંગ/અધર ઓડિયો વિઝ્યુઅલ મીન્સ થકી યોજાનારી

૪૮મી એન્યુઅલ જનરલ મિટીંગ (''એજીએમ'') સંબંધમાં માહિતી.

અત્રે **સ્ચના** આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૪૮મી એજીએમ બુધવાર, ૧૮ જૂન, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યાથી વિડિયો કોન્ફરન્સિંગ (''વીસી'')/ અધર ઓડિયો ઝ્યુઅલ મીન્સ (અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો– 'ઓએવીએમ') થકી કંપની ધાર ૨૦૧૩ની લાગુ જોવાઈઓ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલ સામાન્ય પરિપત્રક નં. ૨૦/૨૦૨૦ તારીખ ૫ મે, ૨૦૨૦ અને સાથે વંચતા સામાન્ય પરિપત્રક નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્રક નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્રક નં. ૦૨/૨૦૨૧ તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, સામાન્ય પરિપત્રક નં. ૧૯/૨૦૨૧ તારીખ ૮ ડિસેમ્બર, ૨૦૨૧, સામાન્ય પરિપત્રક નં. ૨૧/૨૦૨૧ તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧, સામાન્ય પરિપત્રક નં. ૦૨/૨૦૨૨ તારીખ પ મે, ૨૦૨૨, સામાન્ય પરિપત્રક નં. ૧૦/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨, સામાન્ય પરિપત્રક નં. ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ અને સામાન્ય પરિપત્રક નં. ૦૯/૨૦૨૪ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ (એકત્રિત રીતે 'એમસીએ પરિપત્રકો' તરીકે સંદર્ભિત કરાશે) અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પરિપત્રક નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨ મે, ૨૦૨૦ અને સાથે વંચતા પરિપત્રક નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તારીખ ૧૩ મે, ૨૦૨૨, પરિપત્રક નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ પ જાન્યુઆરી, ૨૦૨૩, પરિપત્રક નં. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ અને પરિપત્રક નં. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 તારીખ 3 ઓક્ટોબર, ૨૦૨૪ અંતર્ગત યોજાશે

પૂર્વે રિમોટ ઈ-વોટિંગ થકી ઈલેક્ટ્રોનિક માધ્યમથી અને એજીએમ દરમિયાન ઈ-વોટિંગ પ્રણાલી થકી એજીએમ ખાતે વોટ આપવાનો તેમનો અધિકાર અજમાવવાની સુવિધા પૂરી પાડવા માટે ખશી અનભવે છે.

કાયદાકિય જોગવાઈઓ જણાવ્યા પ્રમાણે, નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે નો વાર્ષિક અહેવાલની ઈલેક્ટ્રોનિક નકલ, એજીએમની સૂચના સહિત જેમાં વીસી/ ઓએવીએમ થકી એજીએમમાં હાજરી આપવાની પ્રક્રિયા અને પદ્ધતિ સમાવિષ્ટ છે તે ટૂંક સમયમાં દરેક સભ્યોને, જેઓ ના ઈ-મેઈલ એડ્રેસીસ કંપની/ ડિપોઝિટરી સહભાગીઓ ('ડીપી') નોંધાયેલા છે તેમને મોકલવામાં આવશે. કંપનીનો વાર્ષિક અહેવાલ એજીએમની સૂચના સહિત કંપનીની વેબસાઈટ <u>www.inoxcva.com</u> પર અને શેરબજારની વેબસાઈટ www.nseindia.com અને www.bseindia.com પર અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડની વેબસાઈટ www.evotingindia.com પર પણ

બુધવાર, ૧૧ જૂન, ૨૦૨૫ (કટ-ઓફફ તારીખ)ના રોજ શેર ધરાવતા સભ્યો એજીએમની સૂચનામાં આપેલી સૂચનાઓનું પાલન કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વોટ આપવાનો તેમનો અધિકાર અજમાવી શકશે.

સભ્યોએ જો તેમના ઈ-મેઈલ એડ્રેસીસ અને/ અથવા તેમનો મોબાઈલ નંબર, પેન અને બેન્કની વિગતો અપડેટ નથી, તેમને નિમ્નલિખિત પ્રક્રિયાનું પાલન કરીને કંપની પાસેથી ઈ– કમ્યુનિકેશન પ્રાપ્ત કરવા માટે કંપની/ ડીપી પાસે તે નોંધાવવા/ અપડેટ કરવાની વિનંતી છે.

આવકવેરા ધારા ૧૯૬૧ની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કંપનીએ તેના શેરધારકોને ચૂકવેલા ડિવિડંડ પર મુકર દરે ટેક્સ એટ સોર્સ (ટીડીએસ) કાપવાનું આવશ્યક છે. ટીડીએસ દર શેરધારકોની નિવાસી સ્થિતિ, તેમના દ્વારા સુપરત અને કંપની દ્વારા સ્વીકારેલા દસ્તાવેજોને આધારે ભિન્ન રહેશે. આથી સભ્યોને ઉક્ત ઉક્ષેખિત પ્રક્રિયાનું પાલન કરીને ઉચ્ચ દરે કર કપાત ટાળવા માટે તેમનો પેન અપડેટ કરવાની વિનંતી છે. સભ્યોને કેફિન ટેકનોલોજીઝ લિમિટેડની વેબસાઈટની મુલાકાત લેવાની અને લાગુ યોગ્ય ટીડીએસ/ વિથહોલ્ડિંગ ટેક્સ રેટ કંપની નક્કી કરી શકે તે માટે ફોર્મ 15G / 15H, કલમ ૧૯૬, ૧૯૭ હેઠળ દસ્તાવેજો, એકપીઆઈ રજિસ્ટ્રેશન સટિફિકેટ, ટેક્સ રેસિડેન્સી સટિફિકેટ, લોઅર ટેક્સ સટિફિકેટ જેવા લાગુ દસ્તાવેજો અપલોડ https://ris.kfintech.com/form15 કરવાની વિનંતી છે. કંપની આરટીએ અથવા ડિપોઝિટરી સહભાગી પાસે જેમની ઈ-મેઈલ આઈડી નોંધણી કરેલી હોય તે બધા શેરધારકોને આ સંબંધમાં ઈમેઈલ મોકલશે.

આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડ વતી જયમીન પટેલ

આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડ INOXCVA

**રજિસ્ટર્ડ ઓફિસઃ** ૯મો માળ, કે પી પ્લેટિના, રેસ કોર્સ, વડોદરા-૩૯૦ ૦૦૭, ગુજરાત ફોન: (+૯૧ ર૬૫) ૬૧૬૦૧૦૦, CIN: L99999GJ1976PLC018945,

કંપની સભ્યોને વીસી/ ઓએવીએમ થકી એજીએમમાં હાજરી આપવાની અને એજીએમ

ડીમટીરિયલાઈઝ્ડ મોડમાં શેર ધરાવતા સભ્યોને તેમના ડિમેટ અકાઉન્ટ જાળવવામાં આવ્યા હોય તે તેમની સુસંગત ડીપી પાસે ઈ-મેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબરો નોંધાવવા/ અપડેટ કરવાની વિનંતી છે.

તારીખઃ ૨૩.૦૫.૨૦૨૫ કંપની સેકેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર સ્થળઃ વડોદરા



અધિકત અધિકારી

અધિકૃત અધિકારી, નોર્થર્ન આર્ક કેપિટલ લિમિટેડ



Place: Waghodia

**Date**: May 23, 2025

## Refund Amount Yet to be Worked Out, says JSW implementation of the resolutional enditors and around the resolution when the property in the property of the resolutional enditors and around the resolution when the property in the property of the resolution of the resolutional enditors and around the resolution when the property of the resolution of the resolu

The SC had ordered BSPL's liquidation. It also ordered that money be refunded to JSW.

JSW said the amount to be refunded was "yet to be worked

ET reported Friday that JSW Steel had asked banks for the refund of payments made as part of the ₹19,700 crore resolution plan for BPSL and that liquidation be delayed for 60 days.

JSW told the Supreme Court that BPSL's assets are significantly different from what they were before the resolution plan took effect due to value accretion. "Any order for initiation of liquidation of BPSL must be passed in respect of BPSL as it stood prior to the date of implementation of the resolution plan," JSW said in its plea to the Supreme Court.

'Consequently, the actions undertaken by JSW upon and after the implementation of the resolution plan, need to be reversed and the position of BPSL and its stakeholders ought to be resto-

tion plan for any liquidation

proceedings to commence.' The court is likely to hear the appeal on Monday as JSW's counsel sought an urgent listing, saying the NCLT is moving ahead fast with the liquidation process." To be sure, the NCLT is also scheduled to hear the Singhal plea on Monday.

The May 2 ruling scrapped Steel's acquisition of BPSL four years after it took place on the grounds that the resolution plan was "illegal" and "in gross violation"

of the Insolvency and Bankruptcy Code (IBC). While directing the NCLT to initiate liquidation proceedings against BPSL, the court had directed that payments made to financial and operational creditors and the equity contribution by JSW be refunded within two months, as undertaken by the lenders to

the bankrupt firm. JSW told the apex court in its fresh appeal the initiation of liquidation will cause irreparabred to the position they were in ledamage to it and stakeholders immediately prior to the date of at large-public sector banks be-cess, Mehta had said.

tional creditors and around

20,000 employees. Therefore, the continuation of NCLT proceedings without addressing and appreciating the legal remedies available to JSW and various other stakeholders would "frustrate the rights" of JSW, the appeal stated. However, this could be an attempt at reopening the case, experts told ET. JSW's appeal assumes importance as the Committee of Creditors had also asked the tri-

bunal to grant more time to as-

sess the impact of the Supreme

Court judgement and assist it

on the way forward. Solicitor general Tushar Mehta had last week told the tribunal that the plan had been implemented, payments had been made to stakeholders and new parties had taken interest in the resolved company, so many issues need to be addressed on the legal implications under the

changed circumstances. Further, other options are under consideration including a fresh corporate insolvency resolution process (CIRP) pro-

### Keep in Touch with Varsity: Counsellors

### >> From Page 1

Those with visas fear they may not be allowed to enter the US. On campus, no one knows where and if they may be forced to transfer, or return home. "It's a huge mess; students are panicking," said Karan Gupta, founder of the eponymous career consultancy, fold ET. "Everyone is expecting Harvard to get a court injunction, in which case things will temporarily go back to normal. But the overall uncertainty will remain in case there are further developments." Social media is abuzz with posts on the US move, calling it everything from a "blatant attack on academic freedom" to a "high-stakes mess for students." But students are maintaining a low profile because "there's a fear that we are being monitored...and there will be consequences," one student told

### **FIGHTBACK**

In a complaint filed in Boston tion of the First Amendment, the Due Process Clause, and the Procedure Act." The move will have "im- ded. Students with multiple ac-

Place: Waghodia

Date : May 23, 2025

mediate and devastating effect for Harvard and more than 7,000 visa holders," it added, ET has seen a copy of the complaint "With the stroke of a pen, the government has sought to erase a quarter of Harvard's student body, international students who contribute significantly to the University and its mission. Without its international students, Harvard is not Harvard," it said. International students make up over 27% of Harvard's student body. Amidst the chaos, consultants are advising students to stay in contact with the university. "We are advising students and parents to keep calm and to keep their options open. We have to remember that the order can be reversed at any point. We are helping with alternative planning as the situation unfolds," said Vibha Kagzi, CEO of study abroad consultancy ReachIvy-.com, herself an MBA from Harvard Business School (HBS). Students need to explofederal court, Harvard called the revocation "a blatant violamay provide. "It could mean they can begin their programmes online, consider deferrals, or explore a gap year," she ad-

ceptance may choose to forfeit their Harvard deposit - and transfer to another college, said consultants while some may look at other destinations including the UK and Europe. "It's a large investment and high risk -some may not be willing to join Harvard now," said Prashant Tibrewal, founder of

Alum-n-i. Meanwhile, a student who has already got a visa to join HBS this fall is worried that it may no longer be valid. Others who have accepted Harvard's offer are wondering if they should cancel visa appointments to av oid rejections.

Some students who have turned down offers from other institutes are hoping that those are sympathetic to their plight and accept them if there are seats available. A former HBS grad told ET that there are also rumours that those who have graduated from Harvard recently and are on optional practical training (OPT) may see it cancelled. "Some people have been asked to work from home temporarily. People are saying that if F1 gets revoked, OPT gets revoked, because they are

## Trump Warns of 50% EU Tariffs Starting June

Washington: US President Donald Trump threatened once again on Friday to ramp up his trade war, recommending a 50% tariff on European

Union goods starting June 1. The threat, delivered via social media, roiled global markets after weeks of deescalation had provided some reprieve. The S&P 500 fell 0.9% in early trading, the Nasdaq fell 1.5%, and European shares fell 1.1%.

Trump's latest broadside against the EU stemmed from his frustration at the lack of progress in trade talks with the bloc. US Treasury Secretary Scott Bessent told Fox News on Friday that the 50% threat will hopefully "light a fire under the EU," adding that other countries have been negotiating with Washington in good faith.

"The European Union, which was formed for the primary purpose of taking advantage of the United States on TRA-

DE, has been very difficult to deal with," Trump wrote on his Truth Social site. "Our discussions with them are going nowhere!"The European Commission on Friday declined to comment on the new threat, saying it would wait for a phone call between EU trade chief Maros Sefcovic and his US counterpart Jamieson Greer scheduled for Friday. Envoys from the 27 EU countries are also due to meet on trade in Brussels la-

Trump's stop-and-start global trade war has rattled markets, sapped US consumer and business confidence and raised investor fears of inflationary pressures and a global economic downturn. In response to falling markets, the White House paused most of the punishing tariffs that Trump announced in early April against nearly every country in the world, leaving in place a 10% baseline tax on most imports. He also cut a massive 145% tax on Chinese goods to 30%

A 50% levy on EU imports could raise consumer prices on everything from German cars to Italian olive oil.

## LUX **LUX INDUSTRIES LIMITED**

CIN: L17309WB1995PLC073053

Regd. Office: 39, KALI KRISHNA TAGORE STREET, KOLKATA - 700 007 Email: info@luxinnerwear.com, Website: www.luxinnerwear.com, Ph: 033-40402121, Fax: 033-40012001

### Promises and performances that ensure comfort

### EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

PARTICULARS		STANDALONE				CONSOLIDATED				
	Quarter Ended			Year Ended		Quarter Ended			Year Ended	
	31.03.2025 (Audited)	31.12.2024 (Un-audited)	31.03.2024 (Audited)	31.03.2025 (Audited)	31.03.2024 (Audited)	31.03.2025 (Audited)	31.12.2024 (Un-audited)	31.03.2024 (Audited)	31.03.2025 (Audited)	31.03.2024 (Audited)
Net Profit / (Loss) before exceptional items and tax	65.73	43.70	77.23	222.23	180.21	65.54	42.57	76.35	220.66	172.23
Net Profit / (Loss) after exceptional items before tax*	65.73	43.70	77.23	222.23	180.21	65.54	42.57	76.35	220.66	172.23
Net Profit / (Loss) after tax attributable to the owners of the Company	48.17	32.64	55.95	166.09	133.57	48.00	31.51	55.09	164.54	125.60
Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	48.06	32.64	56.35	165.98	133.98	47.92	31.51	55.51	164.46	126.03
Equity Share Capital (Face value Rs. 2/- per share)	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26
Other Equity excluding Revaluation Reserve	20	87		1,740.36	1,575.93		7/53	(\$)	1,724.08	1,560.41
Earnings Per Share (Basic & Diluted in Rs.) (Face value Rs. 2/- per share)**	16.02	10.85	18.61	55.23	44.42	15.99	10.66	18.47	54.97	43.07

- There was no exceptional and extra-ordinary item during the above mentioned period
- Not Annualised except for the year ended 31st March, 2024 & 31st March, 2025

Place: Kolkata

Date: May 23, 2025

- 1. The above results have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 23, 2025. The Board of Directors has recommended final dividend of Rs. 2/- (100%) per equity share of Rs. 2/- each for the financial year ended March 31, 2025, which is subject to approval of
- the shareholders in the ensuing Annual General Meeting, The Promoters and Promoter Group have waived their right to receive the Final Dividend for the financial year 2024 25. The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on

By Order of the Board for LUX INDUSTRIES LIMITED

> Ashok Kumar Todi Chairman

> DIN-00053599

Few of our Best Sellers

®CÖŽI *NĪŤŘ* 





the Company's website (www.luxinnerwear.com). The same can be accessed by scanning the QR code provided below.







HON'BLE SUPREME COURT MONITORED HOUSING PROJECTS



Her?

# M

CIN: L99999GJ1987PLC009768

Regd. Office: 9-10, GIDC Industrial Estate, Waghodia - 391 760. Dist.: Vadodara Ph.: 75748 06350 E-mail: co secretary@20microns.com Website: www.20microns.com

Statement of Audited Financial Results (Standalone and Consolidated) for the Quarter and Year Ended March 31, 2025

The Board of Directors of the Company, at its meeting held on **May 23, 2025**, approved the Audited Financial Results (Standalone and Consolidated) of the Company for the quarter and year ended March 31, 2025 ("Financial Results").

The Financial Results have been posted on the Company's website and are accessible at: https://www.20microns.com/financial-result

You may also access the results by scanning the QR code below:




For and on behalf of the Board of Directors 20 Microns Limited

> Rajesh C. Parikh **Chairman & Managing Director**

> > DIN: 00041610

Note: This intimation is made pursuant to Regulation 33 & 52 read with Regulation 47(1) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.



Website: www.20microns.com

### Through Ld. Court Receiver Executed by **NBCC (India) Limited**










A perfect abode for your family





### 3 & 4 BHK Spacious Luxury Apartments

- Project with modern amenities
- Near to Gaur City Mall and in close proximity to renowned hospitals and schools
- India Gate, Anand Vihar ISBT & Railway Station: 30 mins.

e-Auction will be held on: 03.06.2025



FOR MORE DETAILS

Please visit our website:

www.nbccindia.in | www.receiveramrapali.in or Call: 9772907414

